

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન સ્થાનિક ભાગીદારોને સાથે રાખીને વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામ શરૂ કરે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 3, 2022) – સીટી ઓફ બ્રેમ્પટન પોતાના ડાઉનટાઉનમાં સુધારા કરવા ડાઉનટાઉન બ્રેમ્પટન માટે 12-મહિનાના વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામની શરૂઆત કરીને પગલાઓ લેવાનું ચાલુ રાખે છે.

વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામનો હેતુ સ્થાનિક રહેવાસીઓ અને ધંધાઓની જરૂરિયાતો સંબોધીને અને સુરક્ષા સુધારવા મદદ કરીને, ડાઉનટાઉન બ્રેમ્પટનમાં લોકોને લક્ષ્યાંકિત સ્ટ્રીટ આઉટરિચ સર્વિસીસ પૂરી પાડવાનો છે.

આ કાર્યક્રમથી, “વેલકમિંગ સ્ટ્રીટ્સ લીડર્સ” ડાઉનટાઉન બ્રેમ્પટનના ધંધાઓને ટેકો મળશે. અગ્રણીઓ સહાયતા માટેની વિનંતીઓને એવી પરિસ્થિતિઓથી પ્રતિભાવ આપશે જેમાં પીલ રીજીયનલ પોલીસની મદદની જરૂર ના પડે, જેમ કે સંતાપિત લોકો, ડાઉનટાઉનમાં રહેતા લોકો સાથે પ્રવૃત્તમય થઈને સંબંધો બનાવવા, અને તેઓને જરૂર પડી શકે તેવી સેવાઓની સહાયતા કરવા જરૂરિયાતમંદ લોકોની ભલામણ કરવી. અગ્રણીઓ 2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ પર સ્થિત સીટી હોલના ભોંયતળિયે આવેલા ડાઉનટાઉન બ્રેમ્પટન પ્રોજેક્ટ્સ સેન્ટરમાં સ્થિત હશે.

રીજીયન ઓફ પીલ પ્રમાણે, વર્ષ 2020 માં પીલમાં 4,566 લોકો ઘર વગરના હોવાનું અનુભવતા હતા. જૂન 2021 માં, રીજીયન ઓફ પીલે આ કાર્યક્રમ માટે \$250,000 નું ભંડોળ મંજૂર કર્યું, શહેર અને રીજીયન ઓફ પીલની ભાગીદારીમાં, અને ડાઉનટાઉન બ્રેમ્પટન BIA, પીલ રીજીયનલ પોલીસ, રિજનરેશન આઉટરીચ કમ્યુનિટી અને કેનેડિયન મેન્ટલ હેલ્થ એસોસિએશન પીલ ડફરિન દ્વારા સમર્થિત.

વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામ વિશે વધુ જાણવા વેબસાઈટ brampton.ca/downtownbrampton જુઓ.

અવતરણો (ક્વોટ્સ):

“અમારા ભાગીદારોને સાથે રાખીને, અમે આપણું ડાઉનટાઉન સુધારવા ઘણી નોંધપાત્ર પ્રગતિ કરવાનું ચાલુ રાખીએ છીએ જેથી કરીને તે આપણાં ધંધાઓ અને રહેવાસીઓ માટે સુરક્ષિત, સર્વગ્રાહી અને સમૃદ્ધ સ્થળ બની રહે. વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામ ડાઉનટાઉનમાં સ્થિત આપણાં સ્થાનિક રહેવાસીઓ અને ધંધાઓ માટે ચડિયાતી સહાયતા બની રહેશે. અમે આ 12-મહિનાના પાઈલોટ પ્રોગ્રામના પરિણામો જોવા આશાવાદી છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણાં ડાઉનટાઉન બ્રેમ્પટનના ધંધાઓ COVID-19 મહામારીથી ઘણાં પ્રભાવિત થયા છે, અને શહેર રિકવરી તરફ પોતાનાથી શક્ય દરેક રીતે સહાયતા તેઓને કરી રહ્યું છે. વધારે સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાહેર સ્થળો બનાવવાની તકો સુધારીને, અમે આપણાં ડાઉનટાઉનને સૌ માટે વધારે આવકાર્ય બનાવીશું. વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામથી અમને સહાયતા કરવા બદલ અમારા ભાગીદારોનો આભાર.”

- માર્ટિન મિડીરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“જાહેર સુરક્ષા આવકાર્ય, સમૃદ્ધ ડાઉનટાઉન માટે અનિવાર્ય છે, અને શહેર સુરક્ષા-સંબંધિત ચિંતાઓને સંબોધવા આપણાં ધંધાઓ અને રહેવાસીઓ સાથે કાર્ય કરવા કટિબદ્ધ છે. અમારા ભાગીદારોને સાથે રાખીને, અમે વેલકમિંગ સ્ટ્રીટ્સ પાઈલોટ પ્રોગ્રામ વિતરિત કરવા અને બાર મહિનાના સમયમાં પરિણામોનું મૂલ્યાંકન કરવામાં રોમાંચ અનુભવીએ છીએ.”

પૉલ વિસેંટો (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; ઉપાધ્યક્ષ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“અમે શહેરમાં, આપણાં ડાઉનટાઉનને બદલવા માટે કટિબદ્ધ છીએ જેથી કરીને આપણાં ધંધાઓ સમૃદ્ધ થઈ શકે છે અને આપણાં રહેવાસીઓ પાસે રહેવા, કામ કરવા અને રમવા વધારે જાહેર સ્થળો રહે છે. સુરક્ષા આમાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને વેલકમિંગ સ્ટ્રીટ્સ પાર્થલોટ પ્રોગ્રામ સંબંધિત ચિંતાજનક બાબતો સામે પ્રતિક્રિયા કરવામાં અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને ટેકો આપવામાં અમને મદદરૂપ થશે.”

- રિચાર્ડ ફોર્વર્ડ (Richard Forward), કમિશ્નર, આયોજન, નિર્માણ અને આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“વેલકમિંગ સ્ટ્રીટ્સ પાર્થલોટ પ્રોગ્રામ ચડિયાતા સહયોગનું પરિણામ છે. મને બ્રેમ્પટનમાં આ પાર્થલોટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં ખુશી થાય છે, જેથી ખાતરી કરી શકાય કે ડાઉનટાઉન રહેવાસીઓ અને ધંધાઓ માટે બહુ આવકાર્ય સ્થળ બની રહે.”

- નાન્ડો ઈઆનિકા (Nando Iannicca), રીજીયન ઓફ પીલ, પ્રાદેશિક પ્રમુખ

“વેલકમિંગ સ્ટ્રીટ્સ પ્રોગ્રામની શરૂઆતને ટેકો આપવામાં પીલ રીજીયનલ પોલીસને ખુશી થાય છે. અમે કટોકટીમાં અને સહાયતા સેવાઓની જરૂરિયાત ધરાવતા લોકો સાથે બિન-તાકીદની વાતચીતો વધારવામાં મદદ કરવા વિકાસ તરફ દોરી જતી પહેલો માટે હિમાયત કરી છે, અને સીટી ઓફ બ્રેમ્પટન અને રીજીયન ઓફ પીલનો આ પાર્થલોટ પ્રોજેક્ટ તે અભિગમોમાંના એકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અમે ડાઉનટાઉન બ્રેમ્પટનનું આવકાર્ય વાતાવરણ વધારે તીવ્ર બનાવવા અમારા ભાગીદારો સાથે કાર્ય કરવાની આશા રાખીએ છીએ.”

- નિશાન ડુરુઆપ્પા (Nishan Duraipappah), ચીફ ઓફ પોલીસ, પીલ રીજીયનલ પોલીસ

“ડાઉનટાઉન બ્રેમ્પટન BIA ને વેલકમિંગ સ્ટ્રીટ્સ પાર્થલોટ પ્રોગ્રામ જીવંત બનતો જોવામાં રોમાંચ અનુભવે છે. આ કાર્યક્રમ અમારા ધંધાઓ માટે ચડિયાતી સહાયતા પૂરી પાડશે, અને ડાઉનટાઉનને સૌ માટે આનંદ માણવા જેવું વધારે સુરક્ષિત અને સર્વગ્રાહી સ્થળ બનાવવામાં મદદરૂપ થશે.”

- સુઝી ગોડફ્રોય (Suzy Godefroy), એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર, ડાઉનટાઉન બ્રેમ્પટન બિઝનેસ ઈમ્પ્રૂવમેન્ટ એરીયા (BIA)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca